



ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી

(આઈ. એસ. ઓ. ૯૦૦૧:૨૦૧૫ પ્રમાણિત સંસ્થા),

"સમૃદ્ધિ", ૪થો માળ, મક્કાઈ પુલ, નાનપુરા, સુરત - ૩૯૫ ૦૦૧

ફોન નં. ૨૨૯૧૧૧૧

ફેક્સ નં. ૦૨૬૧-૨૪૭૨૩૪૦

E-mail : info@sgcci.in

Website : www.sgcci.in

રેફ નં.

તા : ૨૯/૬/૨૦૨૧

તંત્રીશ્રી, _____ સુરત.

મે. સાહેબશ્રી,

જત નીચેની પ્રેસ નોટ આપના દૈનિકમાં પ્રસિદ્ધ કરી આભારી કરશોજ.

લિ.

આપનો વિશ્વાસુ,


(ડે. સેક્રેટરી)

ચેમ્બર દ્વારા 'અર્બન એગ્રીકલ્ચર : હાઈડ્રોપોનિક્સ ઓપનીંગ ન્યુ એવેન્યુજ' વિશે વેબિનાર યોજાયો

સુરત. ધી સઘર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૨૬ જૂન ૨૦૨૧ના રોજ 'અર્બન એગ્રીકલ્ચર : હાઈડ્રોપોનિક્સ ઓપનીંગ ન્યુ એવેન્યુજ' વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વક્તા તરીકે ભારતમાં હાઈડ્રોપોનિક્સ ક્ષેત્રમાં જાણીતી વ્યક્તિ ડો. પ્રવીણ સિંઘે મહત્વની માહિતી આપી હતી.

ડો. પ્રવીણ સિંઘે જણાવ્યું હતું કે, ખેતીમાં જે ફળફળાદીનું ઉત્પન્ન થાય છે અને આપણે જે આરોગીએ છીએ તે ખરેખર આરોગ્યપ્રદ છે કે નહી તે જોવાની જવાબદારી આપણી છે. આપણે જે શાકભાજી અને ફળો ખરીદીએ છે તેની કવોલિટી સારામાં સારી હોવી જોઈએ. ખાસ કરીને કોરોના કાળમાં લોકો વધારે નાણાં ચૂકવીને પણ આરોગ્યપ્રદ વસ્તુઓ ખરીદવા તરફ વળ્યા છે.

શહેર ફરતેના વિસ્તારોમાં જમીન ઓછી થઈ રહી છે ત્યારે હાઈડ્રોપોનિક્સ ખેતીબાડીનો કોન્સેપ્ટ આવ્યો છે. માટી વગર જે ખેતી કરવામાં આવે છે તેને હાઈડ્રોપોનિક્સ ખેતી કહેવાય છે. પરંપરાગત ખેતીમાં હવા, પાણી, જમીન, બીજ, પ્રકાશ વિગેરેની જરૂર પડે છે. ખેડૂત કોઈ ભૂલ કરે તો જમીન તેને સુધારી લેતી હોય છે. જ્યારે હાઈડ્રોપોનિક્સ ખેતીમાં જમીન સિવાયની બધી જ બાબતો જેવી સીડીંગ, ઇરીગેશન, પ્લાન્ટ પ્રોટેક્શન, હાર્વેસ્ટીંગ, પોસ્ટ હાર્વેસ્ટ અને સ્ટોરેજ વિગેરેનો સમાવેશ થાય છે. આ ખેતીમાં માટી હોતી નથી કે જે ખેડૂતની ભૂલને સુધારી શકે. આથી ખેતી કરવા માટેની આવડત ખેડૂતમાં હોવી અનિવાર્ય છે.

હાઇડ્રોપોનિક્સ પણ ખેતીની એક પદ્ધતિ છે અને તેમાં શ્રો બેગ, ન્યુટ્રીયન્ટ ફિલ્મ ટેકનીક અને ડીપ વોટર કલ્ચર મુજબ ખેતી થાય છે. હાઇડ્રોપોનિક્સ ખેતીમાં કોઇપણ પીક લઇ શકાય છે. કેરી અને જામના ઝાડ પણ વાવી શકાય છે. આ ખેતીમાં સારું વળતર મળે છે અને મર્યાદિત જગ્યામાં ઓછા ખર્ચે સારામાં સારી કવોલિટી મેળવી શકાય છે. જો કે, આ ખેતી માટે ઉચી કેપીટલ કોસ્ટ લાગે છે અને ખેડૂત પાસે હાઇડ્રોપોનિક્સ ખેતી કરવા માટેની પૂરતી સમજ હોવી જ જોઈએ. તેમણે આ ખેતી માટે ઉભી થતી મુશ્કેલીઓ તથા તેની સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી હતી.

તેમણે કહ્યું હતું કે, હાઇડ્રોપોનિક્સ ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર અને પોલિસી બનાવનારાઓની ભૂમિકા મહત્વની બની રહેશે. હાર્ડવેર ફિએટર્સ અને સોફ્ટવેર ડેવલપર્સ દ્વારા સ્ટાર્ટ-અપમાં ઝંપલાવવાની જરૂરિયાત છે. શ્રીન હાઉસ વિગેરે પ્રમોટ કરનારાઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આગળ આવવું પડશે. એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ્સ દ્વારા આ ખેતી અંગેની સ્કીલ રિસોર્સ ડેવલપ કરવા પડશે. જ્યારે અન્ય એજન્સીઓ દ્વારા આ ખેતી દ્વારા ઉત્પાદિત ઉત્પન્નને લોકો સુધી પહોચાડવું પડશે.

ચેમ્બરની એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન ડો. વી. કુમારે સ્વાગત પ્રવચન કરી વેબિનારનું સંચાલન કર્યું હતું.